




TEX INDUSTRIES LTD.



Blue Chip

Corporate Office : 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021
Tel.: 91 22 4353 0400 • E-mail : bluechiptex@gmail.com • Website : bluechiptexindustrieslimited.com
CIN : L17100DN1985PLC005561

Date: 16th May, 2024

To,
Dept. of Corporate Services (CRD)
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001.

Scrip Code: 506981

Sub.: Submission of Newspaper Advertisement issued pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published in Business Standard (English) and Western Times (Gujarati) on 15th May, 2024, pertaining to the notice published pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time (the Rules), for the information of the equity shareholders of the Company whose shares are due for transfer to the Demat Account of Investor Education and Protection Fund Authority under the said Rules.

Further, the aforesaid information is also available on the website of the company at www.bluechiptexindustrieslimited.com.

Kindly take the above on your record and disseminate the same for information of investors.

Thanking You,

Yours faithfully,

For Blue Chip Tex Industries Limited

Meena Jain
Company Secretary & Compliance Officer
Membership No.: ACS 64159

Encl: as above

INSILCO LIMITED
(Under Voluntary Liquidation w.e.f. 25.06.2021)
CIN: L34102UP1988PLC010141
Regd. Office - B-23, Sector-63, Noida, Uttar Pradesh-201301
Phone: 09837923893, Email: insilco@gmail.com, Website: www.insilcoindia.com

Statement of Un-audited Financial Results for the Quarter/ Nine months ended 31st December 2023 (Rs. in Lakhs)

Particulars	Quarter Ended	Year to date	Previous Year Ending	Corresponding 3 months ended in the previous year
	31 Dec 2023	31 Dec 2023	31 Mar 2023	31 Dec 2022
Total Income from operations (net)	3,982	4,108	265	61
(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	3,832	3,533	-758	-290
(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	3,832	3,533	-758	-290
(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	3,577	3,246	-809	-307
Total Comprehensive (Loss) for the period [Comprising (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,577	3,246	-809	-307
Paid up Equity Share Capital	6,272	6,272	6,272	6,272
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		-5,444		
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -				
(a) Basic	5.70	5.18	-1.29	-0.49
(b) Diluted	5.70	5.18	-1.29	-0.49

Note:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Statutory Auditor has issued modified Audit Report on the Standalone Ind AS Financial Statement as at and for the quarter ended December 31, 2023. The full format of the Quarterly/Annual Financial Results alongwith Limited Review Report are available on the website of Stock Exchange (www.bseindia.com) and the Company (www.insilcoindia.com).
The Company does not have any Exceptional and Extraordinary Items to report in above periods.

For and on behalf of Board of Directors of Insilco Limited (Under voluntary liquidation w.e.f. 25.06.2021)
Sd/-
Paremal Narayanan Vinod
Managing Director
DIN : 08803466

Sd/-
Kapila Gupta
Liquidator of Insilco Limited
(Registration no. IBBI/IPA-001/IP-P-02564/2021-2022/13955)
Place : Noida

Date : May 14, 2024 Place : Mumbai Place : Noida

SHRIRAM MUTUAL FUND
SHRIRAM MUTUAL FUND
Shriram House, No. 4 Burkit Road, T. Nagar, Chennai - 600 017
Shriram Asset Management Company Limited (Investment Manager)
Registered Office: 217, 2nd Floor, Swastik Chambers, Near Junction of S.T. & C.S.T. Road, Chembur, Mumbai - 400 071. CIN: L65991MH1994PLC079874; Website: www.shriramamc.in

NOTICE-CUM-ADDENDUM No. 05/2024
NOTICE-CUM-ADDENDUM TO THE STATEMENT OF ADDITIONAL INFORMATION (SAI) OF SHRIRAM MUTUAL FUND
CESSATION OF THE ROLE OF COMPLIANCE OFFICER, MS. SNEHA JAISWAL

NOTICE is hereby given that Ms. Sneha Jaiswal has ceased to be the "Compliance Officer" of Shriram Asset Management Company Limited ("the Company") w.e.f. May 09, 2024.

Pursuant to the cessation of her role as the Compliance Officer, Ms. Sneha Jaiswal ceases to be the Key Personnel of the Company in terms of The Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996.

Consequently, all reference pertaining to Ms. Sneha Jaiswal as a Key Personnel in the Statement of Additional Information (SAI) of Shriram Mutual Fund stands deleted effective above date.

This notice cum addendum forms an integral part of the SAI of Shriram Mutual Fund, read with the addenda issued from time to time.

All other terms and conditions as mentioned in the SAI, read with the addenda issued from time to time, shall remain unchanged.

For Shriram Asset Management Company Limited (Investment Manager of Shriram Mutual Fund)
Sd/-
Tanmoy Sengupta
Head of Operations & Investor Relations Officer

Date : May 14, 2024
Place : Mumbai

For more information, please contact Shriram Asset Management Company Limited, 511-512, Meadows, Sahar Plaza, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 059. Tel: 022 6947 3400, Email: info@shriramamc.in, Website: www.shriramamc.in

Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully.

BLUE CHIP TEX INDUSTRIES LIMITED
CIN: L17100DN1985PLC005561
Registered Office: Plot No. 63-B, Danudiyog Sahakar Sangh Ltd., Village Piparia, Silvassa, UT of Dadra & Nagar Haveli- 396 230
Email Id: bluechiptex@gmail.com, Website: www.bluechiptexindustrieslimited.com, Tel. No.: +91 99040 11553 / +91 22 4353 0400

NOTICE
Notice of Transfer of Equity Shares to Demat Account of the Investor Education and Protection Fund (IEPF) Authority

NOTICE is hereby given that pursuant to the provisions of Section 124 (6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time ("the Rules"), equity shares of the Company in respect of which dividend(s) has not been encashed or claimed by the shareholders of Blue Chip Tex Industries Limited ("the Company") for the last consecutive period of seven (7) years or more, are required to be statutorily transferred by the Company to Demat Account of IEPF Authority established by the Central Government. The unclaimed / unpaid dividend for last seven (7) consecutive years commencing from the dividend for the Financial Year 2016-17 upto Financial Year 2022-23 of certain shareholders, are presently lying with the Company. The unclaimed / unpaid dividend(s) for the Financial Year 2016-17 will be transferred to IEPF by 20th September, 2024.

Accordingly and adhering to the various requirements set out in the Rules, individual communications to the concerned shareholders is being sent at their latest available addresses whose shares are required to be transferred to Demat Account of the IEPF Authority as per the aforesaid Rules for taking appropriate action(s). In case the Company does not receive any communication from the concerned shareholders by 20th September, 2024, the Company shall, with a view to complying with the requirements set out in the Rules, transfer the shares to Demat Account of the IEPF Authority by the due date as per the procedure stipulated in the Rules. Further, the Company has uploaded full details of such shareholders along with the details of their shares which are due for transfer to Demat Account of IEPF Authority, on its website www.bluechiptexindustrieslimited.com. Shareholders are requested to refer to the aforesaid website of the Company to verify the details of their un-encashed dividend(s) and shares that are liable to be transferred to Demat Account of the IEPF Authority.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF authorities, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of transfer of shares to IEPF authorities as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be deemed adequate notice in respect of issue of new share certificate(s) by the company for the purpose of transfer of shares to IEPF authorities pursuant to the Rules.

Any further Dividend on such shares shall be credited to the IEPF and no claim shall lie against the Company in respect of the unclaimed / unpaid Dividend and / or the shares transferred to IEPF. On transfer of the Dividend and the shares to IEPF, the shareholders may claim the same by making an application to IEPF in Form IEPF - 5 as per the procedure prescribed in the Rules. The said Form is available on the website of IEPF viz. www.iepf.gov.in.

In case the Shareholders have any queries on the subject matter and the Rules, they may contact the Company's Registrar and Transfer Agent ("RTA") or the Company at below mentioned addresses:
1. **Bigshare Services Private Limited (RTA)**, Office No SE-2, 6th floor Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East) Mumbai - 400093, Email: investor@bigshareonline.com, Tel No : +91 22 6263 8200, Fax No : +91 22 6263 8299
2. **Blue Chip Tex Industries Limited**, Office no 15-17, 1st floor, Maker Chambers III, Jammalal Bajaj Road, Nariman Point, Mumbai - 400 021, Email Id: bluechiptex@gmail.com, Tel. No. +91 22 4353 0400

By Order of the Board of Directors,
For Blue Chip Tex Industries Limited
Sd/-
Mrs. Meena Jain
Company Secretary & Compliance Officer

Place: Mumbai
Date: 15th May, 2024

BEFORE THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL, BENCH AT HYDERABAD
COMPANY SCHEME PETITION NO. C.P.(CAA)/13/HYD/2024 CONNECTED WITH
COMPANY SCHEME APPLICATION NO. CA/ (CAA) 66/230/HDB/2023
In the matter of the Companies Act, 2013

And
In the matter of Sections 230-232 and other applicable provisions of the Companies Act, 2013

And
In the matter of the Scheme of Amalgamation Among

Pitti Castings Private Limited
CIN: U27310TG2011PTC077833
Registered Office: IVth Floor, Padmaja Land Mark, 6-3-643/401, Somajiguda, Hyderabad, Telangana, 500082

And
...Amalgamating Company 1

Pitti Rail and Engineering Components Limited
CIN: U29100TG2020PLC144524
Registered Office: 6-3-648/401, 4th Floor, Padmaja Land Mark, Somajiguda, Hyderabad, Telangana, 500082

And
...Amalgamating Company 2

Pitti Engineering Limited
CIN: L29253TG1983PLC004141
Registered Office: IVth Floor, Padmaja Land Mark, 6-3-648/401, Somajiguda, Hyderabad, Telangana, 500082

And
...Amalgamated Company

And
Their respective shareholders and creditors

NOTICE OF HEARING OF PETITION

A Joint Petition under Section 230 to 232 of the Companies Act, 2013 and the rules framed thereunder for the sanction of the Scheme of Amalgamation among Pitti Castings Private Limited ("First Petitioner Company") and Pitti Rail and Engineering Components Limited ("Second Petitioner Company") and Pitti Engineering Limited ("Third Petitioner Company") (collectively referred to as Petitioner Companies) and their respective shareholders and creditors ("Scheme") was presented before the Hon'ble National Company Law Tribunal, Hyderabad Bench ("Hon'ble Tribunal") at Hyderabad ("NCLT") vide Company Scheme Petition No. C.P.(CAA)/13/HYD/2024 on April 26, 2024.

In this regard, the Hon'ble Tribunal vide its Order dated April 26, 2024 has fixed the next date of hearing for the said Petition on June 7, 2024.

Any person desirous of supporting or opposing the said Petition should send to the Petitioner Companies' advocate, at the undersigned address, a notice of his/her intention, signed by him/herself or his/her advocate, with his/her name and address, so as to reach the Petitioner Companies' advocate not later than two working days before the date fixed for hearing of the petition. Where he/she seeks to oppose the Petition, the grounds of opposition or a copy of the affidavit shall be furnished with such notice to the Hon'ble Tribunal. A copy of such representation/notice shall also be served on the Petitioner Companies' advocate not less than two working days before the date fixed for the hearing.

A copy of the Petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same.

Sd/-
Prashant Kumar Jain
Samisti Legal LLP
Office No. T 202, Technopolis, 1-10-74/B,
Above Ratnadeep Super Market, Chikoti Gardens,
Begumpet, Hyderabad-500016
Advocates for the Petitioner Companies

Place: Hyderabad
Date : 14th day of May, 2024

MAGADH SUGAR & ENERGY LTD
Registered Office : P.O. Hargaoon, District Sitapur, Uttar Pradesh - 261 121
Phone (05862) 256220, Fax (05862) 256225, CIN : L15122UP2015PLC069632
Web-site : www.birla-sugar.com, E-mail : birlasugar@birla-sugar.com

Extract of the Audited Financial Results for the quarter and year ended 31 March 2024 (₹ in lakhs)

Sr. No.	Particulars	Three months ended	Year ended	Corresponding Three months ended
		31.03.2024	31.03.2024	31.03.2023 in the previous year
		(Audited)	(Audited)	(Audited)
1	Total Income from Operations	28,812.35	1,09,658.03	29,855.21
2	Net Profit for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	6,314.39	15,659.24	5,334.47
3	Net Profit for the period before tax (after Exceptional and / or Extraordinary items)	6,314.39	15,659.24	5,334.47
4	Net Profit for the period after tax (after Exceptional and / or Extraordinary items)	4,687.98	11,640.96	3,505.10
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,653.37	11,610.51	3,475.04
6	Equity Share Capital	1,409.16	1,409.16	1,409.16
7	Other Equity		73,151.60	
	Earning per share (of ₹10/- each) (in ₹):			
	Basic & Diluted	33.27 *	82.61	24.88 *

* Not annualised.

Notes:
1. The above is an extract of the detailed format of the Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results of the Company are available at our website https://www.birla-sugar.com and at website of BSE Limited and National Stock Exchange of India Limited at https://www.bseindia.com and https://www.nseindia.com respectively.
2. The Board of Directors has recommended a dividend of ₹15/- per equity share of ₹10/- each for the year ended 31 March 2024, which includes a special one-time dividend of ₹ 5/- per equity share, subject to approval of Shareholders at the ensuing Annual General Meeting of the Company.

For and on behalf of Board of Directors
MAGADH SUGAR & ENERGY LIMITED
Chandra Shekhar Nopany
Chairperson
DIN - 00014587

Place : Kolkata
Date : 14 May 2024

GP WIND (JANGI) PRIVATE LIMITED
[Regulation 52(8) read with Regulation 52(4) of the SEBI (LODR) Regulations, 2015]
Statement of Unaudited Financial Results for the year ended March 31, 2024

Regd Office:- S2, Lakshmi Nilayam, H.No.326, Begumpeta, 6-3-1186/A/8, Hyderabad-500016, Telangana.
CIN: U40300TG2010PTC070416

Sl. No.	Particulars	Quarter ended	Quarter ended	Previous Year ended
		31-03-2024	31-03-2023	31-12-2023
		(Unaudited)	(Unaudited)	(Audited)
01.	Total Income from Operations	1,307	1,407	6,242
02.	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	188	328	1,968
03.	Net Profit/ (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	188	328	1,358
04.	Net Profit/ (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	141	203	871
05.	Total Comprehensive Income for the Period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	141	203	871
06.	Paid up Equity Share Capital	25,168	25,168	25,168
07.	Reserves (excluding Revaluation Reserve)	(3,760)	(4,569)	(3,901)
08.	Securities Premium Account	-	-	-
09.	Net worth	21,408	20,599	21,267
10.	Paid up Debt Capital / Outstanding Debt	18,053	20,147	19,640
11.	Outstanding Redeemable Preference Shares	-	-	-
12.	Debt Equity Ratio	0.85	0.99	0.96
13.	Earning Per Share (of Rs 10/- each) - (Basic & Diluted)	0.06	0.08	0.35
14.	Capital Redemption Reserve	-	-	-
15.	Debenture Redemption Reserve	-	-	-
16.	Debt Service Coverage Ratio	0.46	0.57	1.29
17.	Interest Service Coverage Ratio	2.11	2.28	2.66

* Outstanding Debentures

Notes:
1. The above Financial results have been approved by the Board of Directors at their meeting held on May 14, 2024.
2. The above results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under section 133 of the Companies Act 2013 ("Act") read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India.
3. The above is an extract of the detailed format of Annual results filed with the Stock Exchanges under Regulation 52 of the LODR Regulations. The full format of the Annual results is available on the website of the NSE Limited (URL: https://www.nseindia.com) and the same is also available on Company's website (URL: https://gpwindjangi.in)
4. For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the National Stock Exchange of India Limited and can be accessed on the web site of NSE.

By Order of the board
For GP Wind (Jangi) Private Limited
Sd/-
(S Sundar Rajan)
Wholetime Director & CFO
DIN: 03594693

Place: Hyderabad
Date : May 14, 2024

JM FINANCIAL HOME LOANS LIMITED
Corporate Identity Number : U65999MH2016PLC288534
Regd. Office : 7th Floor, Chery, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.
Tel. No.: +91 22 6630 3030 / 5075 5050 • Fax No.: +91 22 6630 3223 / 2854 8523
Email: debtcompliance.hfc@jmf.com • Website: www.jmfhome loans.com

EXTRACT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024 (Rupees in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		March 31, 2024 (Unaudited)	March 31, 2023 (Unaudited)	March 31, 2024 (Audited)	March 31, 2023 (Audited)
1	Total Income from Operations	7,088.32	5,434.19	24,375.90	15,669.41
2	Net Profit for the period / year (before tax, Exceptional and / or Extraordinary items)	1,010.53	1,928.27	4,973.39	3,715.02
3	Net Profit for the period / year before tax (after Exceptional and / or Extraordinary items)	1,010.53	1,928.27	4,973.39	3,715.02
4	Net Profit for the period / year after tax (after Exceptional and / or Extraordinary items)	900.60	1,490.60	3,981.08	2,924.20
5	Total Comprehensive Income for the period / year [Comprising Profit / (Loss) for the period / year (after tax) and Other Comprehensive Income (after tax)]	900.92	1,478.28	4,013.82	2,949.84
6	Paid up Equity Share Capital	43,235.37	16,481.92	43,235.37	16,481.92
7	Reserves (excluding revaluation reserve)	8,336.48	14,780.19	8,336.48	14,780.19
8	Securities Premium Account	10,747.45	3,518.08	10,747.45	3,518.08
9	Net worth	62,319.30	34,780.19	6,2319.30	34,780.19
10	Paid up Debt Capital / Outstanding Debt	1,48,690.28	1,03,082.43	1,48,690.28	1,03,082.43
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-
12	Debt Equity Ratio	2.39	2.96	2.39	2.96
13	Earnings per equity share of ₹ 10/- each (for continuing and discontinued operations)				
	(i) Basic EPS (₹) (Not Annualised*)	*0.25	*0.56	1.32	1.15
	(ii) Diluted EPS (₹) (Not Annualised*)	*0.24	*0.53	1.26	1.12
14	Capital Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
15	Debenture Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
16	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable
17	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable	Not Applicable

Notes:
1. The above is an extract of audited financial results for the quarter and year ended March 31, 2024 which have been reviewed by the Audit Committee of the Board, and on its recommendation, have been approved by the Board of Directors at its meeting held on May 14, 2024. The said results have been subjected to audit by the Statutory Auditors of the Company, who have issued an unmodified report thereon.
2. The above is an extract of the detailed format of financial results filed with the BSE Limited ("Stock Exchange") under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("SEBI(LODR)"), as amended. The full format of the financial results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the website of the Company i.e. www.jmfhome loans.com.
3. The other details as required under Regulation 52(4) of the SEBI LODR, as amended, have been submitted to the Stock Exchange and can be accessed at www.bseindia.com and on the website of the Company i.e. www.jmfhome loans.com.
4. Previous period / year figures have been regrouped / reclassified to make them comparable with those of current period.

For and on behalf of the Board of Directors
JM FINANCIAL HOME LOANS LIMITED
Sd/-
Manish Sheth
Managing Director & CEO
DIN : 00109227

Place: Mumbai
Date: May 14, 2024

Andhra Paper Limited
Serving you with pride..

(Corporate Identity Number: L21010AP1964PLC001008)
An ISO 9001:2015, ISO 14001:2015, ISO 45001:2018 Certified Company
Registered Office: Rajahmundry - 533 105, East Godavari District, Andhra Pradesh, India, Phone: 0883 - 2471831
Corporate Office: 31, Chowringhee Road, Park Street, Kolkata - 700 016, India. Tel: +91-33-71500500
Website: www.andhrapaper.com E-mail: bijaykumar.sanku@andhrapaper.com

Extract of Statement of Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2024 (₹ in Lakhs)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		March 31, 2024	December 31, 2023	March 31, 2023	March 31, 2024
		Refer Note 1	(Unaudited)	Refer Note 1	(Audited)
1	Total income	39,225.16	50,070.02	60,391.20	1,89,552.93
2	Net Profit for the period (before tax, exceptional items)	4,558.89	11,620.04	22,323.70	45,564.29
3	Net Profit for the period before tax (after exceptional items)	4,558.89	11,620.04	20,785.33	45,564.29
4	Net Profit for the period after tax	3,841.36	8,246.93	15,390.16	33,973.92
5	Total Comprehensive income for the period [Comprising Profit for the period (after tax) and other Comprehensive income (after tax)]	4,385.16	9,158.69	14,953.27	36,074.27
6	Paid-up Equity Share Capital	3,977.00	3,977.00	3,977.00	3,977.00
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	1,85,343.08
8	Earnings Per Share [(of Rs. 10/- each) (Not annualized)] for continuing operations (Basic and Diluted) (Rs.)	9.66	20.74	38.70	85.43

Notes
1. The above financial results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on May 13, 2024 and May 14, 2024. The results for the year ended March 31, 2024 have been audited and for the quarter ended March 31, 2024 have been reviewed by the statutory auditors. The figures for the 3 months ended March 31, 2024 and corresponding 3 months ended March 31, 2023, are the balancing figures between the audited figures in respect of the full financial year and the year to date figures upto the third quarter of the respective financial years. The statutory auditors of the Company have issued an unmodified report thereon.
2. The Board of Directors at their meeting held on May 14, 2024 have recommended a final dividend of ₹ 10 per share (100% on face value of ₹10 per share).
3. The Company is engaged in the business of manufacture and sale of pulp, paper and paperboards, which in the context of Indian Accounting Standard (Ind AS) - 108 - Operating Segments, is considered as the single operating segment of the Company.
4. During the previous year ended March 31, 2023, on temporary closure of Andhra Pradesh Gas Power Corporation Limited (APGPC), a provision has been created for the value of our investment of ₹ 1,538.37 lakhs, which was valued as on March 31, 2022 at ₹ 1,947.02 lakhs. An amount of ₹ 408.65 lakhs has been debited through Other Comprehensive Income (OCI) and the cost of investment is shown as an exceptional item in the Statement of Profit and Loss for the year ended March 31, 2023.
5. During the current quarter, the Company's production and earnings were severely impacted due to a planned annual outage at the Rajahmundry manufacturing facility, which occurred from February 19, 2024 to March 30, 2024. However, strategically this outage period was also utilised to re-build and upgrade Company's existing pulp production capacity, which shall result in overall improvement in the reliability and efficiency of plant.
6. Subsequent event disclosure: Subsequent to the balance sheet date, the operations at Company's Rajahmundry manufacturing facility ("plant") was interrupted due to workers illegal strike commencing on April 2, 2024. Consequently, on April 24, 2024, a lockout was implemented at the plant to safeguard assets and personnel, following this prompt resolution, the illegal strike was called off by the workers and normal operations was resumed on April 25, 2024.
7. The Board of Directors in their meeting on May 14, 2024 has considered a proposal for sub-division of each of one fully paid up equity share having face value of ₹ 10 each into 5 (Five) fully paid up equity shares having face value of ₹ 2 (two) each subject to regulatory / statutory approval as may be required and the approval of the shareholders of the Company.
8. The above is an extract of the detailed format of Statement of Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2024 are available on the Company's website (www.andhrapaper.com) and on the websites of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com).

By order of the Board
For ANDHRA PAPER LIMITED
Mukesh Jain
Whole-time Director
[Designated as Executive Director]

Place : Rajahmundry
Date : May 14, 2024

